

Visit of Prime Minister to Italy and the UK for the G-20 Summit and World Leaders' Summit of COP-26

October 24, 2021

જી-20 શિખર મંત્રણા અને વર્લ્ડ લીડર્સ સમિટ સીઓપી-26 માટે વડાપ્રધાનની ઇટાલી અને યુકે મુલાકાત

ઓક્ટોબર 24, 2021

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 29 ઓક્ટોબર 2021થી 2 નવેમ્બર 2021 દરમિયાન અનુક્રમે રોમ, ઇટાલી અને ગ્લાસગો, યુનાઈટેડ કિંગડમની 16મી જી-20 સમિટ અને સીઓપી-26ની વિશ્વ નેતાઓની સમિટમાં ભાગ લેવા માટે પ્રવાસ કરશે.

2. ઇટાલીના વડાપ્રધાન મારિયો ડ્રેગીના આમંત્રણ પર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 30-31 ઓક્ટોબર 2021 દરમિયાન રોમમાં 16મી જી-20 સમિટમાં ભાગ લેશે. આ સમિટમાં જી-20ના સભ્ય દેશો, યુરોપિયન યુનિયન અને અન્ય આમંત્રિત દેશો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના રાજ્ય/સરકારના વડાઓ પણ હાજરી આપશે.

3. આ 8મી જી-20 સમિટ હશે જેમાં વડાપ્રધાન ભાગ લેશે. G-20 આંતરરાષ્ટ્રીય આર્થિક સહયોગ માટે અગ્રણી વૈશ્વિક મંચ તરીકે ઉભરી આવ્યું છે. ભારત 2023માં પ્રથમ વખત જી-20 સમિટનું આયોજન કરશે. ઇટાલિયન અધ્યક્ષતા હેઠળ આગામી શિખર મંત્રણા “લોકો, વિશ્વ, સમૃદ્ધિ”ની થિમ પર આધારિત છે. તેમાં (i) મહામારીમાંથી રિકવરી અને વૈશ્વિક આરોગ્ય વ્યવસ્થાને મજબૂત બનાવવા, (ii) આર્થિક રિકવરી અને લવચિકતા, (iii) ક્લાઈમેટ ચેન્જ અને એનર્જી ટ્રાન્ઝિશન, અને (iv) ટકાઉ વિકાસ અને ફૂડ સિક્યોરિટી પર ભાર મુકવામાં આવશે.

4. વડાપ્રધાન કેટલીક દ્વિવપક્ષીય બેઠકો પણ કરશે જેમાં ઇટાલીના વડાપ્રધાન મારિયો ડ્રાગી સાથેની મુલાકાત સામેલ છે.

5. ત્યારબાદ વડાપ્રધાન યુકેના વડાપ્રધાન બોરીસ જોહ્નસનના આમંત્રણ પર યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઈમેટ ચેન્જ (યુએનએફસીસીસી)ની 26મી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ (સીઓપી-26)ની વર્લ્ડ લીડર સમિટમાં હાજરી આપવા ગ્લાસગો જશે. સીઓપી-26 નું આયોજન 31 ઓક્ટોબર 2021થી 12 નવેમ્બર 2021 દરમિયાન યુકેની પ્રેસિડેન્સી હેઠળ ઇટાલી સાથે ભાગીદારીમાં કરવામાં આવી રહ્યું છે. સીઓપી-26નું હાઈ લેવલ સેગમેન્ટ, જેને વર્લ્ડ લીડર્સ સમિટ (ડબલ્યુએલએસ) તરીકે ઓળખવામાં આવે છે તે 1-2 નવેમ્બર 2021 દરમિયાન યોજાશે. આ સમિટમાં 120થી વધુ દેશો/સરકારોના વડાઓ હાજરી આપશે. સીઓપી-26 અસલમાં 2020માં યોજવાની હતી,

પરંતુ કોવિડ-19 રોગચાળાના કારણે તેને 2021 સુધી મુલતવી રાખવામાં આવ્યું હતું.

6. યુએનએફ્સીસીસી આબોહવા પરિવર્તન સામે લડવા માટે વૈશ્વિક ઈચ્છા અને વિઝનને આકાર આપે છે. આ સંમેલનમાં પક્ષકારોની પરિષદ વૈશ્વિક આબોહવા સમિટ તરીકે ઉભરી આવી છે, જે પરિસ્થિતિ જાણવાની અને આગળનો માર્ગ નક્કી કરવાની તક પૂરી પાડે છે. વડાપ્રધાને છેલ્લે 2015માં પેરિસમાં સીઓપી-21માં હાજરી આપી હતી જ્યારે પેરિસ કરાર પૂર્ણ થયો હતો અને જેનો અમલ આ વર્ષથી શરૂ થાય છે. સીઓપી-26 ખાતે તમામ પક્ષો પેરિસ કરાર અમલીકરણ ગાઈડલાઈન્સને પ્રાપ્ત કરવા, ક્લાઈમેન્ટ ફાઈનાન્સ એકઠું કરવા, આબોહવા અનુકુલન, ટેકનોલોજી ડેવલપમેન્ટ અને ટ્રાન્સફર માટેના પગલાંને મજબુત બનાવવા, અને વૈશ્વિક તાપમાનમાં થતા વધારાને મર્યાદિત રાખવાના પેરિસ એગ્રીમેન્ટના લક્ષ્ય સુધી પહોંચવા માટે કામ કરવામાં આવશે.

7. વડાપ્રધાન સીઓપી-26ની સાથે સાથે ઘણી દ્વિવપક્ષીય બેઠકો કરશે જેમાં યુકેના વડા પ્રધાન શ્રી બોરીસ જોલ્ન્સન સાથેની મુલાકાત પણ સામેલ હશે.

નવી દિલ્હી
ઓક્ટોબર 24, 2021

DISCLAIMER: This is an approximate translation. The original is available in English on MEA's website and may be referred to as the official press release.